

વ્યારા વન વિભાગ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭

વ્યારા વન વિભાગ દ્વારા યુવકો/યુવતીઓ માટે નીચે દર્શાવેલ અનેકવિધ હેતુઓ સિધ્ધ થાય તે માટે સરસ મજાનાં ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ નું આયોજન કરવામાં આવેલ છે.

ટ્રેકર્સ પ્રકૃતિની સુંદરતાનો પરીચય મેળવે, પ્રકૃતિનાં સૌંદર્યને કેમેરામાં કેદ કરવા, તેમની શારીરિક ક્ષમતામાં વધારો થાય, તેઓ જંગલનું મહત્વ સમજે, તેમનામાં વન સંરક્ષણ અને સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની લાગણીનું બીજાંકુરણ થાય, રવિવારની રજાને ઉજવણીમાં ફેરવી શકે, જંગલનાં વૃક્ષો ઓળખતા થાય, જંગલમાં વસતા આદિવાસીઓનાં ઉત્થાન માટે યોગદાન આપવાની ભાવનાં વિકસે.....

આ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ ની વિશેષતા એ છે કે, ટ્રેકીંગ કરવા ઈચ્છુક ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ આ સાથે સંકળાયેલ તમામ કામગીરી પેપરલેસ કરીને એક નવો જ ડીજિટલ અભિગમ વ્યારા વન વિભાગ દ્વારા અપનાવવામાં આવેલ છે. તેમજ WhatsApp, Facebook દ્વારા જ આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરીને, ઈન્ટરનેટના માધ્યમથી ટ્રેકર્સ પોતાના મોબાઈલ તેમજ લેપટોપ દ્વારા Online રજીસ્ટ્રેશન કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

વિશેષમાં આ ટ્રેકીંગ પ્રોગ્રામમાં સહભાગી બનતા ટ્રેકર્સ જંગલનું મહત્વ તથા જંગલમાંથી ઉપલબ્ધ થતી વન ઔષધિઓનાં ઉપયોગ વિશેની માહિતી જંગલમાં વસતા આદિવાસી પાસેથી જાણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

વિશેષ આ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ માં

ટ્રેકર્સને પ્લાસ્ટીકનો ઉપયોગ મર્યાદિત કરવા,
જરૂરીયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવા,
સારી વાતોને એપ્રીશીયેટ કરવાની સુટેવ કેળવવા,
ડીજિટલ મીડીયાનો Positive ઉપયોગ કરવા,
ટાઈમ મેનેજમેન્ટનાં મહત્વ.....

વિશે પણ પ્રેરણારૂપ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઉપરાંત આ ટ્રેકીંગ પ્રોગ્રામની સાથે સાથે ટ્રેકર્સ દ્વારા ટ્રેકીંગ દરમ્યાન કેમેરામાં કેદ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સની Photo Competition તથા એકબીજાનાં ફોટોગ્રાફ્સ ગુણવત્તા ડ્રાઈવમાં Share કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ટ્રેકર્સનાં ફિડબેક પણ Online મેળવવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા નીચે ઉપલબ્ધ કરાવેલ રજીસ્ટ્રેશન લીંકમાં રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે. અન્ય તમામ વિગતો રજીસ્ટ્રેશન લીંકમાં ઉપલબ્ધ છે.

રજીસ્ટ્રેશન લીંક :- <https://goo.gl/forms/RBfygJ8YsbgxH14v1>

વ્યારા વન વિભાગની આ વિશેષ પહેલને ચોતરફથી લોકો દ્વારા સોશિયલ મીડીયામાં હકારાત્મક પ્રતિભાવો મળી રહેલ છે.

આભાર સહ

નાયબ વન સંરક્ષક

વ્યારા



વ્યારા વન વિભાગ



Trekking Festival – 2017 Route Details

ટ્રેક નંબર	તારીખ	ટ્રેક રૂટ	હાજર થવાનું સ્થળ	ટ્રેક - કિ.મી
"Into the dense forests"				
૧	૦૨/૦૭/૨૦૧૭	નિંદવાડા નર્સરીનિંદવાડા નર્સરી-અજવાર-આમલદી-	નિંદવાડા ફોરેસ્ટ નર્સરી	૨૦
"Time to go uphill"				
૨	૦૯/૦૭/૧૭	મેઢા-સુરતીયા ડુંગર-મેઢા	દશેરા કોલોની, ફોરેસ્ટ કેમ્પસ, સોનગઢ	૧૮
"No signal.....No problem"				
૩	૧૬/૦૭/૧૭	પીપલવાડા-ધાંગધર-પીપલવાડા	પીપલવાડા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફીસ	૧૦
"Mother of all treks"				
૪	૨૩/૦૭/૧૭	કેલવણ-કાવડીયા ડુંગર- રાજા રાણી ધોધ-કેલવણ	આંબાપાણી રાઉન્ડ ફોરેસ્ટ ઓફીસ	૩૦
"A Peek into the remnants of past"				
૫	૩૦/૦૭/૧૭	ગવલણ નર્સરી- બુધવાડા કિલ્લા- ગવલણ નર્સરી	ગવલણ ફોરેસ્ટ નર્સરી	૧૪
"Beauty of waterfall"				
૬	૦૬/૦૮/૧૭	ચીમેર રાઉન્ડ ઓફીસ-ચીમેર ધોધ- ચીમેર રાઉન્ડ ઓફીસ	ચીમેર રાઉન્ડ ફોરેસ્ટ ઓફીસ	૧૦
"Historical Trek"				
૭	૧૩/૦૮/૧૭	સોનગઢ-સોનગઢ કિલ્લો- સોનગઢ	રંજ ફોરેસ્ટ ઓફીસ, સોનગઢ	૧૦
"Explore the Unexplored"				
૮	૨૦/૦૮/૧૭	શેરૂલા નર્સરી-મસનધરા- તોરન પાણી-શેરૂલા નર્સરી	શેરૂલા ફોરેસ્ટ નર્સરી	૧૮
"Be prepared to be delighted"				
૯	૨૭/૦૮/૧૭	નિંદવાડા નર્સરી-માછીયાવેરી- દેવઘાટ-નિંદવાડા નર્સરી	નિંદવાડા ફોરેસ્ટ નર્સરી	૨૫
"Facebook friendly trek"				
૧૦	૦૩/૦૯/૧૭	ચાંદ સૂર્યા મંદિર-ધુસમાઈ માડી મંદિર- કાળોકાકર ડુંગર-ચાંદસૂર્યા મંદિર	ચાંદ સૂર્યા મંદિર	૧૨

ટ્રેકીંગ માર્ગદર્શન માટે સંપર્ક નંબર - (૧) મંડોરીભાઈ 84608 51880, (૨) રમેશભાઈ 82005 60211